



## Booking of Halls & Auditorium



<b>Hall Name*</b>	<input type="checkbox"/> Gandhi Smruti Bhavan. <input type="checkbox"/> Sardar patel Smruti Bhavan. <input type="checkbox"/> Sanjeev kumar Auditorium. <input type="checkbox"/> Swami Vivekanand Auditorium. <input type="checkbox"/> Perfoming Art Centre Auditorium.			
<b>Program Type*</b>	<input type="checkbox"/> Rehearsal રીહર્સલ	<input type="checkbox"/> Religious meeting / Lectures Without Ticket ધાર્મિક મીટીંગ/ પ્રવચન ટિકિટ વિના	<input type="checkbox"/> Religious meeting / Lectures With Ticket ધાર્મિક મીટીંગ/ પ્રવચન ટિકિટ સાથે	<input type="checkbox"/> Arangetram / Sastriya Nrutya / Ras-Garba આરંગેત્રમ/ શાસ્ત્રીય નૃત્ય/ રાસ-ગરબા
	<input type="checkbox"/> Natak નાટક	<input type="checkbox"/> Bhajan / Dayro ભજન/ ડાયરો	<input type="checkbox"/> Kavi sammelan / Musayro / Kavvali કવિ સંમેલન/ મુશાયરો/ કવ્વાલી	<input type="checkbox"/> Comedy Show / Magic Show કોમેડી શો/ જાદુ
	<input type="checkbox"/> Filmy Geet Sangit / Sugam Geet Sangit / Orcestra /Karoke ફિલ્મી ગીત-સંગીત/ સુગમ ગીત-સંગીત/ ઓરકેસ્ટ્રા/ કરાઓકે	<input type="checkbox"/> Seminar / Workshop / Business Meeting / Annual Meeting / Share Holder Meeting સેમીનાર/ વર્કશોપ/ બીઝનેસ મીટીંગ/ વાર્ષિક મીટીંગ/ શેરહોલ્ડર મીટીંગ	<input type="checkbox"/> Dance Show / Boogie- Woogie /Belay Dance ડાન્સ શો/ બુગી-વુગી/ બેલી ડાન્સ	<input type="checkbox"/> Samajik Sanskrutik Program / School Program(Meeting, Seminar, Cultural Program, Annual Function, Award Function) સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમ/ શાળાકીય કાર્યક્રમ(મીટીંગ, સેમીનાર, સાંસ્કૃતિક કાર્યક્રમ, વાર્ષિક મહોત્સવ, ઈનામ વિતરણ)
<b>Location of Applicant/ Organisor*</b>	<input type="checkbox"/> Within SMC Limit <input type="checkbox"/> Outside SMC Limit			
<b>Booking Date*</b>	DD/MM/YYYY			
<b>Session*</b>	<input type="checkbox"/> 09:30 – 13:00 <input type="checkbox"/> 15:00 – 18:30 <input type="checkbox"/> 21:00 – 00:30			
<b>Name of Organization/ Applicant*</b>				
	(Cheque/NEFT for refund od deposit if any will be issued in above name only)			
<b>Responsible Person*</b>				
<b>PAN*</b>				
<b>TAN</b>				
<b>Address For Communication*</b>				
<b>City*</b>				
<b>State*</b>				
<b>Email ID*</b>				
<b>Phone No.*</b>				
<b>Mobile Number*</b>				
<b>Provide Bank Details for Refund Process</b>				
<b>(Submit Cancellation Cheque within 1 day at Concern Auditorium)</b>				
<b>Account Holder Name*</b>	NAME SHOULD BE SAME AS PER NAME OF ORGANIZATION/APPLICANT			
<b>Bank Account Number*</b>				
<b>MICR Code*</b>				
<b>IFSC Code*</b>				

**Note:** For booking within 7-30 days, the payment must be made in cash/D.D. only.

I have read and agree to abide by the Terms and condition

**NAME & SIGNATURE**